

## સામાયિક કરવાના પાઠ

પાઠ ૧ :- નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં.

પાઠ ૨ :- તિક્ખુત્તો આયાહિણં પાયાહિણં વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્લાણં મંગલં દેવયં ચેઈયં પજ્જુવાસામિ.

પાઠ ૩ :- ઈચ્છામિ પડિક્કમિઉં ઈરિયાવહિયાએ વિરાહણાએ ગમણાગમણે પાણકમણે બીયકમણે હરિયકમણે ઓસા ઉત્તિંગ પણગ દગ મટ્ટી મક્કડા સંતાણા સંકમણે જે મે જીવા વિરાહિયા એગિંદિયા બેઈદિયા તેઈદિયા ચઉરિંદિયા પચિંદિયા અભિહયા વત્તિયા લેસિયા સંઘાઈયા સંઘટ્ટિયા પરિયાવિયા કિલામિયા ઉદવિયા ઠાણાઓ ઠાણં સંકામિયા જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છા મિ દુક્કડં.

પાઠ ૪ :- તસ્સ ઉત્તરી-કરણેણં પાયચ્છિત્ત-કરણેણં વિસોહી-કરણેણં વિસલ્લી-કરણેણં પાવાણં કમ્માણં નિગ્ધાયણદ્વાએ ઠામિ કાઉસ્સગ્ગં અન્નત્થ ઊસસિએણં નિસસિએણં ખાસિએણં ધીએણં જંભાઈએણં ઉડ્ડુએણં વાયનિસગ્ગેણં ભમલીએ પિત્તમુચ્છાએ સુહુમેહિં અંગ સંયાલેહિં સુહુમેહિં ખેલ સંયાલેહિં સુહુમેહિં દિટ્ઠિ સંયાલેહિં એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુજ્જ મેં કાઉસ્સગ્ગો જાવ અરિહંતાણં ભગવંતાણં નમોક્કારેણં ન પારેમિ તાવ કાયં ઠાણેણં મોણેણં ઠાણેણં અપ્પાણં વોસિરામિ.( કાઉસ્સગ્ગ મુદ્રા ધારણ કરી નીચેનો પાઠ બોલવો )

પાઠ ૩ :- (મનમાં બોલવું) ઈચ્છામિ પડિક્કમિઉં ઈરિયાવહિયાએ વિરાહણાએ ગમણાગમણે પાણકમણે બીયકમણે હરિયકમણે ઓસા ઉત્તિંગ પણગ દગ મટ્ટી મક્કડા સંતાણા સંકમણે જે મે જીવા વિરાહિયા એગિંદિયા બેઈદિયા તેઈદિયા ચઉરિંદિયા પચિંદિયા અભિહયા વત્તિયા લેસિયા સંઘાઈયા સંઘટ્ટિયા પરિયાવિયા કિલામિયા ઉદવિયા ઠાણાઓ ઠાણં સંકામિયા જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છા મિ દુક્કડં . નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં. (પ્રગટ પણે બોલવું) નમો અરિહંતાણં

પાઠ ૫ :- લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિત્થયરે જિણે ; અરિહંતે કિત્તઈસ્સં, ચઉવીસં પિ કેવલી. ઉસભમજિયં ચ વંદે, સંભવમભિનંદણં ચ સુમઈ ચ ; પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે. સુવિહિં ચ પુપ્ફદંતં, સીયલ સિજ્જંસ વાસુપુજ્જં ચ ; વિમલમણંત ચ જિણં, ધમ્મં સંતિં ચ વંદામિ. કુંથું અરં ચ મહિં, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ ; વંદામિ રિક્કનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ. એવંમએ અભિથુઆ, વિહુયરય-મલા પહીણ જર મરણા ; ચઉવીસં પિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ, કિત્તિય વંદિય મહિયા, જે એ લોગ્ગસ ઉત્તમા સિદ્ધા ; આરુગ્ગ બોહિલાભં, સમાહિ વર મુત્તમં દિંતુ. ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા ; સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. ( હવે ગુરુદેવ બિરાજતા હોય તો તેઓને અને ન હોય તો સીમંધર સ્વામી ને તિક્ખુત્તો ના પાઠ નંબર બે થી ત્રણ વાર સવિધિ વંદના કરવી )

પાઠ ૬ :- દ્રવ્ય થકી સાવજ્જ જોગ સેવવાનાં પર્યકખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે કાળ થકી બે ઘડી ઉપરાંત ન પાળું ત્યાં સુધી ભાવ થકી છ કોટિએ પર્યકખાણ કરેમિ ભંતે ! સામાઈયં સાવજ્જં જોગં પર્યકખામિ. જાવ નિયમં પજ્જુવાસામિ દુવિહં તિવિહેણં ન કરેમિ ન કારવેમિ મણસા વયસા કાયસા. તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ( હવે ડાબો ઠીચણ ઊભો રાખી નીચેનો પાઠ બોલવો )

પાઠ ૭-૧ :- પહેલું નમોત્થુણં શ્રી સિદ્ધ ભગવંતોને કરું છું .... નમોત્થુણં અરિહંતાણં ભગવંતાણં. આઈગરાણં તિત્થયરાણં સયં-સંબુદ્ધાણં. પુરિસુત્તમાણં પુરિસસિહાણં પુરિસવર પુંડરિયાણં પુરિસવર ગંધહત્થીણં. લોગુત્તમાણં લોગનાહાણં લોગહિયાણં લોગપઈવાણં લોગપજ્જોયગરાણં અભયદયાણં ચક્રબુદ્ધયાણં મગ્ગદયાણં સરણદયાણં જીવદયાણં બોહિદયાણં ધમ્મદયાણં ધમ્મદેસયાણં ધમ્મનાયગાણં ધમ્મસારહીણં ધમ્મવર આઉરંત ચક્કવટ્ટીણં દીવોત્તાણં શરણ ગઈ પઈટ્ટાણં અપ્પહિહય-વરનાણ દંસણધરાણં વિયટ્ટ છઉમાણં જિણાણં જાવયાણં તિન્નાણં તારયાણં બુદ્ધાણં બોહયાણં મુત્તાણં મોયગાણં સવ્વન્નુણં સવ્વદરિસીણં સિવ મયલ મરૂય મણંત મક્ખય મવ્વાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયં ઠાણં સંપત્તાણં નમો જિણાણં જિય ભયાણં.

પાઠ ૭-૨ :- બીજું નમોત્થુણં શ્રી અરિહંતદેવોને કરું છું .... નમોત્થુણં અરિહંતાણં ભગવંતાણં. આઈગરાણં તિત્થયરાણં સયં-સંબુદ્ધાણં. પુરિસુત્તમાણં પુરિસસિહાણં પુરિસવર પુંડરિયાણં પુરિસવર ગંધહત્થીણં. લોગુત્તમાણં લોગનાહાણં લોગહિયાણં લોગપઈવાણં લોગપજ્જોયગરાણં અભયદયાણં ચક્રબુદ્ધયાણં મગ્ગદયાણં સરણદયાણં જીવદયાણં બોહિદયાણં ધમ્મદયાણં ધમ્મદેસયાણં ધમ્મનાયગાણં ધમ્મસારહીણં ધમ્મવર આઉરંત ચક્કવટ્ટીણં દીવોત્તાણં શરણ ગઈ પઈટ્ટાણં અપ્પહિહય-વરનાણ દંસણધરાણં વિયટ્ટ છઉમાણં જિણાણં જાવયાણં તિન્નાણં તારયાણં બુદ્ધાણં બોહયાણં મુત્તાણં મોયગાણં સવ્વન્નુણં સવ્વદરિસીણં સિવ મયલ મરૂય મણંત મક્ખય મવ્વાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયં ઠાણં સંપાવિઉ-કામાણં

પાઠ ૭-૩ :- ત્રીજું નમોત્થુણં મારા (તમારા) ધર્મગુરૂ, ધર્માચાર્ય, ધર્મોપદેશક, સમ્યક્ત્વરૂપી બોધિબીજનાં દાતાર, જિનશાસનના શણગાર એવી અનેક સર્વ શુભ ઉપમાએ કરી બિરાજમાન, જે જે સાધુ-સાધ્વીજીઓ વીતરાગદેવની આજ્ઞામાં જ્યાં જ્યાં વિચરતાં હશે, ત્યાં ત્યાં તેઓને મારી (તમારી) સમય સમયની વંદના હજો. તિક્કબુત્તો ના પાઠ નંબર બે થી બેઠા બેઠા ત્રણ વાર વંદના કરવી

સંકલનકાર: CA. જયેશ મોહનલાલ શેઠ, બોરીવલી.

નોંધ: સંકલનકારના પુસ્તકો, અન્ય લેખો અને ચિંતન કણીકાઓ JAYESHSHETH.COM ઉપર ઉપલબ્ધ છે.